

APPENDICES

Scale For Multidimensional Parenting

Constructed by :

Dr. N. S. CHAUHAN

M. A., (Phil) M. A., (Psy.) Ph. D., D. Litt. A. M. I. A. L.

Professor & Head,

Dr. C. P. KHOKHAR

M. A., M. Phil, Ph. D.

Dr. V. SINGH

M. A., M. Phil, Ph. D.


कृपया निम्नलिखित सग्त विवरण दीजिये

नाम.....	शिक्षा.....
आयु.....	ग्रामीण/शहरी.....
लिंग.....	आर्थिक स्तर.....
व्यवसाय.....	पता.....
दिनांक.....	

निर्देश

- (१) प्रस्तुत प्रपत्र मे बच्चों से सम्बन्धित कुछ कथन है।
- (२) प्रत्येक कथन को ध्यान पूर्वक पढ़िये और उत्तर हेतु दिये गये सहमति स्तर मे जो भी आपके लिये नहीं है, उसके रेखांकित पर (—) निशान लगाइये।
- (३) उत्तरों का विवरण इस प्रकार है :—बहुत अधिक अधिक साधारण कम बहुत कम बिल्कुल
सहमत सहमत सहमत सहमत सहमत नहीं
(.....) (.....) (.....) (.....) (.....) (.....)
- (४) प्रत्येक प्रश्न के लिये केवल एक ही उत्तर पर सही का निशान लगाना है।
- (५) सभी प्रश्न का उत्तर दीजिये।
- (६) सभी उत्तर सही माने जायेंगे व गोपनीय रहे जायेंगे।

1985



MAPA

INSTITUTE OF ADVANCED STUDIES
MEERUT UNIVERSITY
MEERUT

	बहुत अधिक सहमत	अधिक सहमत	साधारण सहमत	कम सहमत	बहुत कम सहमत	बिल्कुल नहीं सहमत
(१) अपने बच्चों के अच्छे भोजन व वस्त्र प्रबन्ध सम्बन्धित विचार मेरे मन में दबाया रहता है।	...	...	...	...	...	...
(२) बच्चों द्वारा आवश्यकतानुभव करने मात्र पर ही उसे पूरा कर देता हूँ।	...	...	...	...	...	...
(३) सीमित मुख्य-सुविधा ही अपने बच्चों को प्रदान करती हूँ।	...	...	...	...	...	...
(४) मेरे बच्चों की उन्नति-ध्रुवों मेरे उत्साहवर्द्धन में निम्न होती है।	...	...	...	...	...	...
(५) बच्चों की उनकी प्रत्येक उपलब्धि पर पुरस्कृत करता हूँ।	...	...	...	...	...	...
(६) बच्चों की समस्या के प्रति गंभीर सहानुभूति प्रदर्शित करता हूँ।	...	...	...	...	...	...
(७) दुनियादारी में व्यस्त रहने के कारण मैं बच्चों की आवश्यकता पूर्ति में असमर्थ रहता हूँ।	...	...	...	...	...	...
(८) बच्चों के रहन-सहन की ओर मेरा ध्यान कम रहता है।	...	...	...	...	...	...
(९) जब भी बच्चा मुझ करता हुआ नजर आता है मैं उसकी प्रशंसा में मुग्ध न कुछ अवश्य कह जाता हूँ।	...	...	...	...	...	...
(१०) बच्चों की रुचि उत्साह एवम् मनोरंजन का ध्यान रखता हूँ।	...	...	...	...	...	...
(११) मेरा आदेश बच्चों के लिये उनकी भावनाओं आदि सभी से सर्वोपरि होता है।	...	...	...	...	...	...
(१२) बच्चों को सौंपा गया काम मैं सदैव पूरा देखना चाहता हूँ ऐसा न होने पर शोधित हो जाता हूँ।	...	...	...	...	...	...
(१३) बच्चों की जिज्ञासा का सहानुभूतिपूर्ण जवाब देता हूँ।	...	...	...	...	...	...
(१४) पर मैं बच्चों को अपनी प्रत्येक बात कहने की पूर्ण स्वतन्त्रता है।	...	...	...	...	...	...
(१५) बच्चों के समक्ष उनकी असफलताओं को ज्यादा रखता हूँ।	...	...	...	...	...	...
(१६) अपने बच्चों की सफलताओं पर भी मेरी खूबी अव्यक्त ही रहती है।	...	...	...	...	...	...
(१७) मेरे बच्चों की शिक्षा में विषय एवं स्कूल चुनने की पूर्ण स्वतन्त्रता होती है।	...	...	...	...	...	...
(१८) बच्चों में सम्बन्धित कार्य में मैं बच्चों की सलाह अवश्य लेता हूँ।	...	...	...	...	...	...
(१९) बच्चों द्वारा की गयी मेरी आलोचना मुझे सहनीय है।	...	...	...	...	...	...
(२०) बच्चों के सामाजिक सम्बन्ध मेरे नियन्त्रण से बाहर है।	...	...	...	...	...	...
(२१) मेरे बच्चों को अपने खेल/मनोरंजन में प्रत्येक निर्णय लेने की पूर्ण स्वतन्त्रता है।	...	...	...	...	...	...
(२२) भोजन, शिक्षा, वस्त्रादि प्रबन्ध में सदैव मैं अपने बच्चों का विशेष ध्यान रखता हूँ।	...	...	...	...	...	...
(२३) व्यक्तित्व आधुनिकता व्यर्थ है मैं बच्चों से वही पुराने रीति-रिवाज अपनाने को कहता हूँ।	...	...	...	...	...	...

	बहुत आधिक सहमत	अधिक सहमत	साधारण सहमत	कम सहमत	बहुत कम सहमत	बिना महती सहमत
-) बच्चों का सिनेमा या टेलीविजन जाने पर मेरा प्रतिक्रिया होता है।	...	...	...	...	...	...
५) हमने दुनिया देखी है, 'तुम अभी बच्चे हो' जैसा हम कहते हैं बंग बरो।	...	...	...	...	...	...
६) बच्चों का गलत-बुरा आदि प्रवर्ण मेरी इच्छा से होता है।	...	...	...	...	...	...
- ७) परिवार का आदर करने हेतु मैं बच्चों का सहारा भी ले लेता हूँ।	...	...	...	...	...	...
८) बच्चों की अत्यधिक वस्तुओं उपलब्ध करने में अतनय	...	...	...	...	...	...
९) मैं अपने बच्चों को गरीब उनके उपनाम (गरीब, गरीब आदि) से पुकारता हूँ।	...	...	...	...	...	...
१०) बच्चा घर लौटने पर बच्चों का आलिंगन कर चुम्बन कर लेता हूँ।	...	...	...	...	...	...
११) बच्चों की इतनी जिज्ञासा है कि सभी का उत्तर देना मेरे लिये असह्य है।	...	...	...	...	...	...
१२) पर घृणी से परेशान होकर बच्चों को भी-भी गालियाँ देता हूँ।	...	...	...	...	...	...
१३) कार्य में व्यस्त बच्चों को उत्साहित करने की आदत सी पड़ गयी है।	...	...	...	...	...	...
१४) अपने बचपन की भावनाएँ एवं इच्छाओं को समाप्त हुए बच्चों की इच्छा पूर्ति करता हूँ।	...	...	...	...	...	...
१५) बच्चों की हरकतें मुझे उन्हें गालियाँ देने पर गजबूर कर देती है।	...	...	...	...	...	...
१६) मैं बच्चों को साथ लेकर सिनेमा देखने कम ही जाता हूँ।	...	...	...	...	...	...
१७) जब भी घूमने जाता हूँ बच्चों को साथ ले जाता हूँ।	...	...	...	...	...	...
१८) बच्चों की अधिकाधिक इच्छा पूर्ति में मुझे एक अजीबो-गरीब सा आनन्द आता है।	...	...	...	...	...	...
१९) गलती सुधारने के लिये दण्ड प्रावधान सही है। मैं इसे बच्चों पर भी लागू कर देता हूँ।	...	...	...	...	...	...
२०) बच्चों को सोपा गया प्रत्येक काम में समय पर देखना चाहता हूँ उपेक्षा मेरे लिये असह्य है।	...	...	...	...	...	...
२१) बच्चों के जेब खर्च का ध्यान रखता हूँ।	...	...	...	...	...	...
२२) मेरे बच्चों को बलब जाने व अपनी उम्र के (लड़के/लड़कियों) को दोस्त नाने की पूर्ण स्थिति है।	...	...	...	...	...	...
२३) मैं बार-बार कुछ न कुछ पूछते रहना मुझे अच्छा नहीं लगता पर उन्हें डाँट भी देता हूँ।	...	...	...	...	...	...
२४) सुविधायें उपलब्ध कराने पर भी बच्चों की असफलताएँ उन्हें उन के लिये भयानक कर देती है।	...	...	...	...	...	...

	बहुत जाधिक सहमत	अधिक सहमत	माध्यम सहमत	कम सहमत	बहुत कम सहमत	बिल्कुल गहरी सहमत
(४५) बच्चों से बात करते समय उसकी भावनाओं व इच्छाओं का ध्यान रखा जाता है।	...	...	...	...	...	...
(४६) बच्चों द्वारा की गयी गहरी आलोचना मुझे रसोदार है।	...	...	...	...	...	...
(४७) बच्चों के मूल्यांकन में उनका समस्त आलोचनात्मक योगदान अपनाया गेरा गया है।	...	...	...	...	...	...
(४८) बच्चों की शिक्षणयत्न में प्रान्तीयता रूढ़ि है।	...	...	...	...	...	...
(४९) बच्चों को उनकी आयु के अनुसार ही उत्तरदायित्व दी जाती है।	...	...	...	...	...	...
(५०) बच्चों के लिए मैं सर्वांगीण शिक्षा व पत्र-पत्रिकाओं का प्रयत्न करने का पूर्ण प्रयास करता हूँ।	...	...	...	...	...	...
(५१) मेरे बच्चों को सीमित स्वतन्त्रताओं में रखा जाता है।	...	...	...	...	...	...
(५२) उपलब्ध सुविधाओं में ही संतोष कर ला-ज्यादा की इच्छा नहीं ऐसा करता रहता हूँ।	...	...	...	...	...	...
(५३) दूसरों के घर जाने, मित्र बनाने आदि में बच्चों को मेरे से आज्ञा लेनी होती है।	...	...	...	...	...	...
(५४) बच्चों का असमय खान-पान व मनोरंजन मुझे क्रोधित होने पर मजबूर कर देता है।	...	...	...	...	...	...
(५५) बच्चों की जिन इच्छाओं को मैं पूरा नहीं कर सकता यदि वे उन्हें बार-बार दोहराते हैं तो गुस्सा आ जाता है।	...	...	...	...	...	...
(५६) अपनी अयोग्यता के कारण बच्चों पर अक्रुश नहीं लगा पाया हूँ।	...	...	...	...	...	...

૧. અ. મને ઉદાસી લાગતી નથી.
બ. મને ઉદાસી લાગે છે.
ક. હું બધો જ સમય ઉદાસ રહું છું અને તેમાથી બહાર નીકળી શકતો નથી.
ડ. હું એટલો બધો ઉદાસ અથવા દુઃખી છું કે હું ઉભો રહી શકતો નથી.
૨. અ. હું સ્પષ્ટપણે ભવિષ્ય વિશે હતાશ થયો નથી.
બ. મને ભવિષ્ય વિષે હતાશા લાગે છે.
ક. મને લાગે છે મારા માટે આગળ જોવા કશું જ નથી.
ડ. મને લાગે છે હું એક માણસ તરફે સંપૂર્ણપણે નાસીપાસ થયેલો છું.
૩. અ. મને નાસીપાસ થયા જેવું લાગતું નથી.
બ. મને લાગે છે કે હું સામાન્ય માણસ કરતાં વધારે નાસીપાસ થયો છું.
ક. આજે હું મારી પાછળની છંદગીઓમાં જોઉં છું તો મને ઘણી બધી નાપાસીઓ દેખાય છે.
ડ. મને લાગે છે કે એક માણસ તરીકે હું સંપૂર્ણ નાસીપાસ થયેલો છું.
૪. અ. મને પહેલાની જેમ જ વસ્તુઓમાંથી વધારે સંતોષ મળે છે.
બ. હું પહેલાની જેમ જ વસ્તુઓની મજા લઈ શકતો નથી.
ક. મને સારો સંતોષ કશામાંથી હવે મળતો નથી.
ડ. હું બધાથી ઓછો મજા મળી રહ્યો છું. હું અથવા કંટાળી ગયો છું.
૫. અ. મને સ્પષ્ટપણે લઘુતાગ્રંથી લાગે છે.
બ. મને સમયતા થોડા ઘણા ભાવ માટે લઘુતાગ્રંથિ લાગે છે.
ક. મને મોટા ભાગના સમય માટે લઘુતાગ્રંથિ લાગે છે.
ડ. મને બધી જ સમય લઘુતાગ્રંથિ લાગે છે.
૬. અ. મને નથી લાગતું મને સજા મળી રહી છે.
બ. મને લાગે છે મને સજા થઈ શકે.
ક. હું સજાની આશા રાખું છું.
ડ. મને લાગે છે મને સજા મળી રહી છે.
૭. અ. મને મારામાં હતાશા લાગતી નથી.
બ. હું મારી રીતે હતાશ છું.
ક. હું મારી જાતને ગંદી ગણું છું.
ડ. હું મારી જાતને પિસ્કારું છું.
૮. અ. મને નથી લાગતું કે હું બીજા બધા કરતા ખરાબ છું.
બ. હું મારી અશક્તિઓની અથવા ભૂલોની ખોડ કાઢું છું.
ક. હું મારી જાતનો હંમેશા મારી ભૂલો માટે વાંક કાઢ્યા કરું છું.
ડ. કશું પણ ખરાબ થાય તો તેના માટે હું મારી જાતનો વાંક કાઢ્યા કરું છું.

૯. અ. મને મારી જાતને મારવાના કોઈ વિચાર આવતા નથી.
 બ. મને મારી જાતને મારવાના વિચાર આવતા હતો પણ હું તેને બહાર પ્રદર્શિત નહિ કરું.
 ક. મને મારી જાતને મારી નાખવી ગમે છે.
 ડ. જો મને મોકો મળ્યો તો હું મારી જાતને મારી નાખીશ.
૧૦. અ. હું સામાન્યતઃ વધુ રડતો નથી.
 બ. હું અત્યારે પહેલા કરતા વધારે રડું છું.
 ક. હું અત્યારે બધો જ સમય રડું છું.
 ડ. હું પહેલા હું રડી શકતો હતો પણ અત્યારે મારે રડવું હોય તો પણ હું રડી શકતો નથી.
૧૧. અ. હું અત્યારે પહેલા ક્યારેય નહિ કંટાળ્યો હોઈ એટલો બધો કંટાળી ગયો છું.
 બ. હું પહેલા કરતાં વધુ સહેલાઈથી ગુસ્સે થાઉં છું અને કંટાળી જાઉં છું.
 ક. મને બધો જ સમય કંટાળો લાગે છે.
 ડ. પહેલા જે વસ્તુઓથી હું કંટાળતો હતો તેનાથી અત્યારે હું જરાયે કંટાળતો નથી.
૧૨. અ. મેં બીજા લોકોમાં રસ ગુમાવ્યો નથી.
 બ. હું પહેલા કરતા અત્યારે બીજા માણસોમાં ઓછો રસ ધરાવું છું.
 ક. મેં મારો મોટા ભાગનો રસ બીજા માણસોમાં ગુમાવ્યો છે.
 ડ. મેં મારો બધો જ રસ બીજા માણસોમાં ગુમાવ્યો છે.
૧૩. અ. હું વધુ રીતે નિર્જોયો બનાવું છું.
 બ. મેં પહેલા કરતા નિર્જોયો બનાવવાનું ઓછું ક્યું છે.
 ક. મને નિર્જોયો નક્કી કરવામાં પહેલા કરતા વધુ મુશ્કેલી પડે છે.
 ડ. હું નિર્જોયો નક્કી કરવાને જરા પણ શક્યમાન નથી.
૧૪. અ. મને નથી લાગતું કે હું પહેલા કરતા ખરાબ લાગું છું.
 બ. મું વૃદ્ધ અને અનાકર્ષક લાગું છું તે બાબતે મને ચિંતા થાય છે.
 ક. મને લાગે છે કે મારા દેખાવમાં કાંઈક સુધારાઓ છે જે મને અનાકર્ષક બનાવે છે.
 ડ. હું માનું છું કે હું કદરૂપો (ખરાબ) દેખાઉં છું.
૧૫. અ. હું પાતેલાની જેમ જ કામ કરી શકું છું.
 બ. કશુંક કામ શરૂ કરવા માટે પ્રયાસ કરવો પડે છે.
 ક. મારે મારી જાતને કશુંક કરવા માટે પક્કો મારવો પડે છે.
 ડ. હું કંઈ પણ કામ કરવાને શક્યમાન નથી.

૧૬. અ. હું સામાન્યતઃ સારી રીતે ઊંઘી શકું છું.
 બ. હું પહેલાની જે સારી રીતે ઊંઘી શકતો નથી.
 ક. હું હંમેશા કરતાં ૧-૨ કલાક વ્હેલો જાગું છું અને પાછો સુવામાં તકલીફ અનુભવું છું.
 ડ. હું પહેલા કરતાં કેટલાક કલાકો જલ્દી ઉઠું છું અને પાછો સુઈ શકતો નથી.
૧૭. અ. હું હંમેશા કરતા થાકતો નથી.
 બ. પહેલા કરતાં હું વધુ સહેલાઈથી થાકી જઉં છું.
 ક. હું ધણુંખરૂ બધાથી થાકી ગયો છું.
 ડ. હું કશું પણ કરવા માટે ખુબ જ થાકી જઉં છું.
૧૮. અ. મારી ભુખ હંમેશા કરતા ખરાબ નથી.
 બ. મારી ભુખ પહેલા જેટલી સારી નથી.
 ક. મારી ભુખ અત્યારે ખુબ જ ખરાબ છે.
 ડ. મને જરાય ભુખ લાગતી જ નથી.
૧૯. અ. હંમણાથી મારું વજન ઊંચું નથી.
 બ. મેં ૫ પાઉન્ડ કરતા વધારે વજન ગુમાવ્યું છે.
 ક. મેં ૧૦ પાઉન્ડ કરતા વધારે વજન ગુમાવ્યું છે.
 ડ. મેં ૧૫ પાઉન્ડ કરતાં વધારે વજન ગુમાવ્યું છે.
૨૦. અ. મને હંમેશા કરતા મારા સ્વાસ્થ્ય માટે ચિંતા નથી.
 બ. હું મારી શારીરિક મુશ્કેલીઓ મને દુઃખાવાઓ જેમકે પેટ દર્દ અથવા બંધકોશ માટે ચિંતિત છું.
 ક. હું શારીરિક તકલીફો માટે ચિંતિત છું કે અત્યારે બીજા કશા માટે વિચારવું મુશ્કેલ છે.
 ડ. હું મારી શારીરિક તકલીફો માટે એટલો બધો ચિંતિત છું કે બીજા કશા માટે વિચારી શકતો નથી.
૨૧. અ. મેં અત્યારે મારા સેક્સ પ્રત્યેના રસમાં કોઈ બદલાવ નોંધ્યો નથી.
 બ. હું પહેલા કરતા સેક્સમાં ઓછો રસ ધરાવું છું.
 ક. અત્યારે મારો સેક્સમાં રસ ખુબ જ ઓછો થઈ ગયો છે.
 ડ. મેં સંપૂર્ણપણે સેક્સમાં રસ ગુમાવી દીધો છે.

ધી રોટર ઈન્ટરનલ - એક્ઝામ્નલ લોકસ ઓફ કંટ્રોલ

૧. ----- અ. મા-બાપની વધુ પડતી સજાને કારણે બાળકો તોફાની બની જાય છે.
----- બ. મા-બાપના સહેલાઈભર્યા વર્તનને કારણે મોટા ભાગના બાળકો તોફાની બની જાય છે.
- 12 ૨. ----- અ. મોટા ભાગની ઉઠાસીમાં લોકોની જીંદગીઓમાં અંશતઃ ખરાબ નસીબને લીધે હોય છે.
----- બ. લોકોનું ખરાબ નસીબ તેમની પોતાની ભુલોનું પરિણામ છે.
૩. ----- અ. અમારે યુદ્ધ હોવાનું બધામાંનું એક મોટું કારણ એ છે કે લોકો રાજકારણમાં પુરતો રસ લેતા નથી.
E ----- બ. લોકો ગમે તેટલું તેને રોકવા પ્રયત્ન કરે યુદ્ધ તો હંમેશા થશે જ.
૪. ----- અ. લાંબા સમયે લોકો દુનીયા માં તેમને યોગ્ય રીતે મળવું જોઈતું માન મેળવશે.
13 ----- બ. કમનસીબે, એક વ્યક્તિનો ગુણ ધણું ખરું અજાણખાચેલો જ રહે છે, ગમે તેટલો પ્રયત્ન કરવા છતાંય.
૫. ----- અ. શીશ્વકો વિધાર્થીઓને અન્યાય કરે છે તે વિચાર વાહિયાત છે.
14 ----- બ. મોટા ભાગના વિધાર્થીઓ સમજતાં નથી કે તેમના માર્ક્સને અચાનક થતી વસ્તુઓને અસર થાય છે.
- E ૬. ----- અ. તક વિના અસરકારક ઉપરી નથી બની શકતો.
----- બ. પકોંથી વળે તેવા માણસો જેઓ ઉપરી બનવામાં નિષ્ફળ ગયા છે તેમણે તેમને મળેલી તકનો ઉપયોગ કર્યો નથી.
- E ૭. ----- અ. તમે ગમે તેટલો પ્રયત્ન કરો કેટલાક લોકોને તમે ગમતાં જ નથી.
----- બ. જે લોકો બીજાને પોતાની તરફ આકર્ષી નથી શકતાં તેઓ બીજા સાથે કેવો વ્યવહાર કરવો તે સમજતાં નથી.
૮. ----- અ. માણસની અભિવ્યક્તિ નક્કી કરવામાં વારસો અગત્યનો ભાગ ભજવે છે.
----- બ. વ્યક્તિ કેવી છે તે જીંદગીમાં અનુભવ પરથી નક્કી થાય છે.
- E ૯. ----- અ. મે ઘણીવાર શોધ્યું છે કે જે થવાનું છે તે થશે જ.
----- બ. નસીબ પર વિશ્વાસ ક્યારેય મારા માટે નિયત સમયમાં નિર્ણય નક્કી કરવામાં સારો નીવડ્યા નથી.
૧૦. ----- અ. સારી રીતે તૈયાર થયેલા વિધાર્થીઓના કિસ્સામાં ખોટી પરીક્ષા જેથી કોઈ વસ્તુ ક્યારેક જ હોય છે.
E ----- બ. ઘણી વખત પરીક્ષાના પ્રશ્નો કામકાજ સાથે એટલા બધા અસંગત હોય છે કે તેમને અજવાબ નિરર્થક હોય છે.

૧૧. ----- અ. સફળતા મળવી કડક કાર્યનું પરીણામ છે. નસીબ પાસે બહુ થોડું અથવા તો ક્યારેક નથી કરવાનું તેની સાથે.
- E 12. ----- બ. સારી નોકરી મળવી ખાસ કરીને સારી જગ્યાએ અને સારા સ્થળે નભાવું હોય છે.
૧૨. ----- અ. સામાન્ય નાગરીક સરકારી નીણંધોમાં સારી અસર પરાવતો હોઈ શકે.
- E 13. ----- બ. આ દુનિયા અમુક બળવાન માણસોથી ચાલે છે સામાન્ય માણસો તેમાં કંઈ કરી શકતા નથી.
14. ----- અ. જ્યારે હું નકશા ઘડું છું ત્યારે હું ચોક્કસ હોઉં છું કે હું તેમને કામમાં મુકીશ.
- E 15. ----- બ. હમોશ લાંબા વિચારોના નકશાઓ બુદ્ધિ ભરેલા હોતા નથી કારણકે ઘણી વસ્તુઓ સારા અને ખરાબ નસીબનું પરીણામ હોય છે.
16. ----- અ. અમુક ચોક્કસ લોકો છે જેઓ જરાય સારા નથી.
- બ. બધાનામાં કંઈક સારું હોય છે
17. ----- અ. મારા કિસ્સામાં હું જે કંઈ થોડું મેળવું છું તેને નસીબ સાથે કંઈ લેવાદેવા નથી.
- E 18. ----- બ. ઘણી વખત આપણે જ ખાસી સિક્કો ઉછાળીને નક્કી જ કરવાનું હોય છે.
- E 19. ----- અ. લીડર કોણ બને છે એ તેના પર નભે છે કે સારી જગ્યાએ પહેલા પહોંચવામાં નસીબદાર કોણ બને છે.
- બ. લોકોને યોગ્ય જગ્યાએ કેમ પહોંચાડવા તે તેમની કાર્યક્ષમતા પર નભે છે નસીબને તેની સાથે થોડી અથવા જરાય લેવાદેવા નથી.
- E 20. ----- અ. જ્યાં સુધી દુનિયાના કિસ્સાઓ સંકળાયેલા છે. આપણામાના મોટા ભાગના બળાના ગુલાબ છે, આપણે સમજી શકતા નથી કે રોકી શકતા નથી
- બ. રાજકારણ અને સામાજિક ઘટનાઓમાં સક્રિય ભાગ લઈને લોકો દુન્યવી ઘટનાઓને કાબુમાં રાખી શકે છે.
- E 21. ----- અ. મોટા ભાગના લોકો એ હદ સમજી શકતા નથી કે ક્યાં સુધી તેમની જીંદગીઓ આકસ્મિક ઘટનાઓ સાથે સંકળાયેલી છે.
- બ. સાચે જ નસીબ જેવી કોઈ વસ્તુ નથી.
22. ----- અ. દરેક માણસ હમોશ પોતાની ભુલો કબુલવા માટે ઈચ્છા પરાવતો હોવો જોઈએ.
- બ. સામાન્ય રીતે એકની ભુલ ઢાંકવી શ્રેષ્ઠ છે.
- E 23. ----- અ. એ જાણવું અઘરું છે કે માણસ સાથે જ તમને ગમે છે કે નહિ.
- બ. તમાર કટલા મિત્રા છ ત તેની પર નભે છે કે તમા કટલા સારા વ્યક્તિ છ.
- E 24. ----- અ. લાંબી જ દોડમા ખરાબ વસ્તુઓ સારી વસ્તુઓને સમતોલ કરવા થાય છે
- બ. મોટા ભાગના ખરાબ નસીબો કાર્યક્ષમતા અજ્ઞાનતા આગસ અથવા તો ત્રણેયનું પરિણામ હોય છે.

૨૨ અ. સભાગ પ્રયાસથી આપણે રાજકારણીય બજારનાર નાબૂદ કરી શકીએ છીએ.

13 બ. જે વસ્તુઓ રાજકારણીઓ કચેરીઓમાં કરે છે તેના પર કાબુ મેળવવો લોકો માટે મુશ્કેલ છે.

14 ૨૩ અ. કેટલીકવાર હું સમજી શકતી નથી કે શિલ્પકો કવી રીતે ટકા આપે છે.

 બ. કેટલી મુશ્કેલીથી હું બાજુ છું અને ટકા મેળવું છું તે બંને વચ્ચે સીધું જોડાણ છે.

૨૪. અ. એક સારો ઉપરી આશા રાખે છે લોકો પાસે કે તેમણે શું કરવું તે તેમણે જાતે નક્કી કરવું જોઈએ.

 બ. એક સારો ઉપરી બધા સાથે મેં રમવા કરે છે કે તેમનું કામ શું છે.

15 ૨૫. અ. ઘણીવાર મને એવું લાગે છે મારી સાથે જે થાય છે તેની મારા ઉપર થોડી અસર છે.

 બ. મારા માટે એ માનવું અશક્ય છે કે નસીબ મારા જીવનમાં થોડી અસર છે.

૨૬. અ. લોકો એકલા છે કારણકે તેઓ મિત્રભાવ કેળવતા નથી.

 બ. લોકોને ખુશ કરવામાં વધુ પ્રયત્ન નથી કરતો પડતો કારણકે તેઓને તમે ગમશો તો તમે ગમશો જ.

૨૭. અ. ઉચ્ચ શાળામાં ખેલકુદ પર વધુ ભાર મુકવામાં આવે છે.

 બ. જુથ રમતો ચરિત્ર ઘડવાનો શ્રેષ્ઠ રસ્તો છે.

૨૮. અ. મને જે થાય છે તે મારા પોતાના જ કર્મ છે.

E બ. કેટલીકવાર મને લાગે છે કે મારામાં મારી જીંદગી જે દિશા લઈ રહી છે તેના પર પુરતો કાબુ નથી.

16 ૨૯. અ. મોટા ભાગના સમયે હું સમજી શકતી નથી કે રાજકારણીઓ કમ આ રીતે વર્તી રહ્યા છે.

 બ. લાંબા ગાળે ખરાબ સરકાર માટે લોકો જ જવાબદાર છે. રાજકીય અને સામાન્ય ધોરણે.

બેઝ અનુકૂલન પ્રશ્નાવલિ
(પુખ્ત વયના માટે)

નામ :..... ઉંમર :..... જાતિ:.....

સૈદ્ધાંતિક ચોખ્ખતા:..... ધંધો :.....

માસિક આવક :..... પરણેલા કે કુંવારા :.....

અરનામું :..... રાજ્ય :.....

તારીખ :..... અન્ય લાચકાતો:.....

ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી
ફેકલ્ટી ઓફ બેજઅનુકૂલન એન્ડ સાયકોલોજી
એમ. એસ. યુનિવર્સિટી ઓફ બરોડા.
બરોડા.

સૂચના :—નીચે આપેલ ટેસ્ટ તમારું વ્યક્તિત્વ માપવા માટે છે. તેથી તમે બધા વાક્યો કાળજીપૂર્વક વાંચી નીચે આપેલ કોલમમાં તમારું મતવ્ય (હા) (ના) (અનિશ્ચિત) લખેલ કોલમમાં (✓) ટીક કરીને જણાવશો.

આ ટેસ્ટમાં ૨૦ વાક્યો સાચા કે ખોટા નેત્રું કાઢ છે ૩૮ નહીં. તમે આપેલા ૨૦ વાક્યો ખાતરી નાખવામાં આવશે.

	ના.	અનિશ્ચિત	હા
	૧	૨	૩
૧—એ તમને તમારા સામાજિક જીવનનો આનંદ માણવામાં અત્યારનું તમારું રહેઠાણ કોઈ પણ રીતે નડતરરૂપ લાગે છે ?	()	()	()
૨—ડી કોઈ દેખીતા કારણ વચ્ચે તમારો મીનજ બગડે છે ?	()	()	()
૩—બી પ્રસંગોપાત તમે ચામડીના કોઈ રોગ કે બીજા પ્રકારના યુગ્મકોથી પીડાઓ છો ?	()	()	()
૪—સી તમે તમારા ઉપરી પાસે કામની માત્રાથી કરવામાં શરમ અનુભવો છો કે આત્મસભાન થઈ જાઓ છો ?	()	()	()
૫—ઈ તમે તમારી વર્તમાન નોકરી અંગે ક્યારેય અધીરપણું અથવા અશાંતિ અનુભવો છો ?	()	()	()
૬—બી તમને ક્યારેય હૃદય, મૂત્રપિંડ કે ફેફસાની બિમારી હતી ?	()	()	()
૭—એ તમને લાગે છે કે તમારું અત્યારનું રહેઠાણનું વાતાવરણ તમને પોતાનું વ્યક્તિત્વ વિકસાવવામાં તમને પૂરતી તક આપે છે ?	()	()	()
૮—સી તમને સામાજિક તહેવારો કે પ્રસંગોમાં ભાગ લેવું મમે છે ?	()	()	()
૯—સી તમે પોતાના વ્યવસાયની ખોટી પસંદગી કરી હોય તેમ લાગે છે ?	()	()	()
૧૦—ડી તમને નુકસાનકારક ન હોય એવી કોઈ વસ્તુનો તમને ક્યારેય ડર લાગ્યો છે ?	()	()	()
૧૧—ઈ તમારા કુટુંબનો કોઈ પણ સભ્ય ખૂબ જ ટીલા માનસિક રીતે છે ?	()	()	()
૧૨—સી તમારી અત્યારની નોકરી તમને દર વર્ષે રળાઓ ગાળવાનો સમય આપે છે ?	()	()	()
૧૩—સી તમે ક્યારેય લોહીની અછતથી બીમાર રહ્યા છો ?	()	()	()
૧૪—ડી તમે તમારું અભિમાન ધવાય એવા બનાવની ખૂબ ચિંતા કરી કરો છો ?	()	()	()
૧૫—સી તમે નવાજણ (અજણ માણસ) સાથે વાત કરવામાં અડચણ અનુભવો છો ?	()	()	()
૧૬—એ તમારે કઈ જાતનો વ્યવસાય કરવો જોઈએ તે અંગે તમારે તમારા માતાપિતા સાથે મતભેદ થાય છે ?	()	()	()
૧૭—સી તમારી પાસે તમારી વાત તૈયાર કરી રજૂ કરવા માટે સમય હોય નહીં અને કોઈ તમને બોલવા કહે તો તમે બેચેની અનુભવો છો ?	()	()	()
૧૮—ડી કોઈ ચોક્કસ અર્થવિહીન વિચાર તમારા મનમાં આવ્યા કરે છે ?	()	()	()
૧૯—બી તમને બીજાઓથી શરદીનો ચેપ જલદી લાગે છે ?	()	()	()
૨૦—ઈ શું તમને લાગે છે કે નોકરીમાં બઢતી માટે કે પત્રાવધાન માટે તમારે કાવાદાવા કરવા ૩૮ જોઈએ ?	()	()	()

	ના ૧	અનિશ્ચિત ૨	હા. ૩
૧૧-ની સામાજિક પ્રવ્રેશમાં તમે પાછળ રહો છો ? (પડતો બાજુ ભજવ્યો છે ?)	()	()	()
૨૨-એ તમને ધર્મ કે ગંજનીતિને લીધે તમારી સાથે રહેતી કોઈ વ્યક્તિ સાથે અણબનાવ થાય છે ?	()	()	()
૨૩-હી તમે જલદીથી ખેત્રેન થઈ જાવ છો ?	()	()	()
૩૪-બી તમને તમારી તબિયતની કાળજી લેવી જરૂરી લાગે છે ?	()	()	()
૨૫-એ તમારા કોઈ નજીકના સંબંધીમાં છૂટાછેડા લેવાનો પ્રસંગ બન્યો છે ?	()	()	()
૨૬-ઈ તમે ક્યા નોકરી કરો છો એ લોકો તમારી સાથે હંમેશા સારી રીતે વર્તે છે ?	()	()	()
૨૭-બી ખરેખર બુધ્ધ ન લાગી હોય તોપણ તમે હજીપૂર્વક જમો છો ?	()	()	()
૨૮-હી તમે વારંવાર ઉત્તેજિત થઈ જાવ છો ?	()	()	()
૨૯-સી બધા લોકો ભેગા મળી બેઠા હોય ત્યાંથી જીભા થઈ જવા માટે ગમ માગતા તમે મુઝવણ અનુભવો છો ?	()	()	()
૩૦-ઈ તમને લાગે છે કે તમારી અત્યારની નોકરીમાં તમારે ખૂબ લાભો સમયકામ કરવું પડે છે ?	()	()	()
૩૧ એ તમારા વ્યક્તિગત દેખાવની ટીકા કરી તમારા ધરના કોઈ પાત્ર સભ્યે તમને દુખી કર્યા છે ?	()	()	()
૩૨-બી તમને લાગે છે કે તમારે ખૂબ ઓળખીતાઓ કંઈક ઘોડા માદ મિત્ર હોવા નોઈએ ?	()	()	()
૩૩-બી તમારે કોઈ એવી જિભારી હતી કે જેમાંથી તમે જિલકુલ સારા થયા નથી એમ તમને લાગે છે ?	()	()	()
૩૪-હી કોઈની ટીકા ટીપણથી તમે ખૂબ ખેત્રેન થઈ જાવ છો ?	()	()	()
૩૫-એ અત્યારના તમારા ધરના વાતાવરણથી તમે ખુશ અને સંતોષી છો ?	()	()	()
૩૬-ઇ તમારી અત્યારની નોકરી છોડી બીજી નોકરી લેવાનો તમારો વિચાર છે ?	()	()	()
૩૭-સી ધણી સામાજિક મેળાવાઓમાં તમે લોકોના આકર્ષણનું કેન્દ્ર બનો છો ?	()	()	()
૩૮-બી તમને વારંવાર માથાના સખત દુઃખાવાની તકલીફ છે ?	()	()	()
૩૯-હા રોડ ઉપર ચાલતા લોકો તમને નોંધા કરતા હશે એ વિચારથી તમે મુઝવણ અનુભવો છો ?	()	()	()
૪૦-એ તમારા કુટુંબમાંથી તમને પૂરતો પ્રેમ ન મળતો હોય કે દેખલાળ ન રખાતી હોય તેમ લાગે છે ?	()	()	()
૪૧-ઈ તમે તમારા માલિકની સરખામણીમાં ક્યા છો એ જાણી તમને દુઃખ થાય છે ?	()	()	()
૪૨-બી તમે સ્વાસ્થની તકલીફમાં કોઈ રોગથી પીડાવ છો ?	()	()	()
૪૩-હી લોકો તમારા વિચારો જાણી જાય છે એ ચિંતા તમને સતારે છે ?	()	()	()

	ના ૧	અભિપ્રાય ૨	હા ૩
૪૪-સી તમે જલદી મિત્રો બનાવી શકો છો ?	()	()	()
૪૫-ઈ તમને લાગે છે કે તમારા ઉપરી કે માલિક તમને વ્યક્તિગત રીતે પસંદ કરતા નથી ?	()	()	()
૪૬-એ તમે અત્યારે જે લોકો સાથે રહો છો તેઓ તમને પૂરેપૂરા સમજે છે અને તમારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે ?	()	()	()
૪૭-સી તમે સ્વપ્નોમાં રાજ્યશાનો પ્રસંગ કરો છો ?	()	()	()
૪૮-બી કોઈ પણ બિમારીથી તમને હાથમી ખોડ થઈ છે ?	()	()	()
૪૯-ઈ તમારો અત્યારની નોકરીમાં તમને નાપસંદ હોય એવા કોઈ લોકો સાથે તમારે કામ કરવું પડે છે ?	()	()	()
૫૦-સી રૂમમાં થોડા લોકો બેસી વાતો કરતા હોય ત્યારે અંદર જતા તમે ખચકાઓ છો ?	()	()	()
૫૧-એ તમને લાગે છે કે તમારા મિત્રો તમારા કરતાં સુખી જીવન જીવે છે ?	()	()	()
૫૨-સી લોકો વચ્ચે બોલતાં તમે ખચકાઓ છો કે રખે ને તમે કાઈ બોલો ને કરું ખોટું થઈ જશે ?	()	()	()
૫૩-બી શરદીથી છુટવા માટે તમને મુશ્કેલી પડે છે ?	()	()	()
૫૪-ડી વિચારો તમને જીંધવા દેતા નથી એમ માને છે ?	()	()	()
૫૫-એ અત્યારે તમારી સાથે રહેતી હોય એવી કોઈ પણ વ્યક્તિ તમારી ઉપર સંદેહાઈથી શરસે થઈ જાય છે ?	()	()	()
૫૬-ઈ તમારી ઉપર નબળતા હોય તે લોકોનું પૂરું કરવા પૂરતો પત્રાર તમને મળે છે ?	()	()	()
૫૭-બી તમને જિંદગી કે નીચા રકતદબાવ (બ્લડપ્રેશર) રોગ છે ?	()	()	()
૫૮-ડી તમને તમારી શક્ય કમનસીબીની ચિંતા સતાવ્યા કરે છે ?	()	()	()
૫૯-સી સભામાં થોડા આવે તો આગળની જગ્યા ઉપર બેસવા કરતા બિગા ઢંહેનું કે પાછા ચાલ્યા જવાનું તમે પસંદ કરો છો ?	()	()	()
૬૦-ઈ તમારો ઉપરી એક એવી વ્યક્તિ છે કે જેની ઉપર તમે વિશ્વાસ મૂકી શકો એમ તમને લાગે છે ?	()	()	()
૬૧-બી તમને દમનો રોગ છે ?	()	()	()
૬૨-એ તમારા કુટુંબના સભ્યો એકબીજાને માફક આવે (એકબીજા સાથે હજીમળાને રહે) તેવા છે ?	()	()	()
૬૩-સી લગ્નસમયે ભ કે પાટીમાં તમે અત્યંતની વ્યક્તિને મળવાનું પસંદ કરો છો ?	()	()	()
૬૪-ઈ તમને લાગે છે કે તમને યોગ્ય પત્રાર મળે છે ?	()	()	()
૬૫-ડી તમારી લાગણી જલદીથી ધવાય છે તેમ તમને લાગે છે ?	()	()	()
૬૬-બી તમને વારંવાર કબજાવાત રહે છે ?	()	()	()

	અનિશ્ચિત	હા.
	૧	૨
૧૭-એ તમારી સાથે રહેતી કોઈ વ્યક્તિને તમે ખૂબ જ તાપસંદ કરો છો ?	()	()
૧૮-સી તમે કોઈ સામાજિક પ્રસંગે આવેવાની લો છો ?	()	()
૧૯-ધ તમે તમારી સાથે નોકરી કરતા દરેક લોકોને ચાહો છો ?	()	()
૨૦-ડી તમને ચિંતા રહ્યા કરે છે કે દરેક વસ્તુ થોડા (સાચી) હોતી નથી ?	()	()
૨૧-ઈ તમારા નજીકના સંગ્રા પ્રત્યે તમને પ્રેમ અને તિરસ્કારની વિરોધાભાસી લાગણી રહે છે ?	()	()
૨૨-સી તમે જે વ્યક્તિને ખૂબ પસંદ કરતા હો (જેને ખૂબ વખાણતા હો) પણ સારી રીતે ઓળખતા ન હો તેવી વ્યક્તિની હાજરીમાં તમે સભાન (બેચેન) થઈ જાવ છો ?	()	()
૨૩-બી તમને વારંવાર ઝાડ કે ઊલટી યાવ છે ?	()	()
૨૪-ડી તમે શરમાળ છો ?	()	()
૨૫-એ તમારી સાથે રહેતી કોઈ વ્યક્તિના કોઈ પત્રલાથી (કોઈ પ્રકારના વર્તનથી) તમે માનસિક નબળાઈની કે દબાણની લાગણી અનુભવો છો ?	()	()
૨૬-સી છેલ્લા પાંચ વર્ષ દરમિયાન તમે વારંવાર નોકરી બદલી છે ?	()	()
૨૭-સી કોઈને ન મળવાની છત્રછાથી તમે તેનાથી દૂર રહેવા પ્રયત્ન કરો છો ?	()	()
૨૮-ડી તમે કાકડા કે બીજા પ્રકારના રોગથી પીડાઓ છો ?	()	()
૨૯-ડી તમારા દેખાવ અંગે તમે બેચેન (આત્મસભાન) રહો છો ?	()	()
૩૦-ઈ તમારી અભિપ્રાયની નોકરી તમને ખૂબ થકવી નાખે છે ?	()	()
૩૧-એ તમારા કુટુંબમાં વારંવાર મુશ્કેલીઓ કે અડચણ ઊભા થાય છે ?	()	()
૩૨-ડી તમે પોતાની જાનને માનસિક રીતે બેચેન માનો છો ?	()	()
૩૩-સી તમે સામાજિક નાચત્રાનનો અધનંદ માણો છો ?	()	()
૩૪-બી તમે અપચતના રોગથી પીડાઓ છો ?	()	()
૩૫-એ તમારા માતા કે પિતા તમે તેમની સાથે રહેતા ત્યારે તમારી વર્તણૂક બાળતમા મૂલ કાળ્ય કરતા ?	()	()
૩૬-ઈ તમને લાગે છે કે તમારી નોકરીમાં તમને તમારા વિચારો જણાવવાની પૂરતી તક મળે છે ?	()	()
૩૭-સી ગરદનસભામાં બોલના તમે અચકાઓ છો ?	()	()
૩૮-બી તમે કાયમ થાક અનુભવો છો ?	()	()
૩૯-ઈ તમને એમ લાગે છે કે તમારો પત્રાર એટલો ઓછો છે કે તમારી આર્થિક જરૂરિયાતો પૂરી નહિ કરી શકે ?	()	()
૪૦-ડી તમે લઘુતામર્થિ(નીચાપણની લાગણીયા)થી પીડાઓ છો ?	()	()

	ના. ૧	અનિશ્ચિત ૨	હા. ૩
૯૧-એ તમે જે સોડો સાથે રહેતા હો તેમની અંતર ટેવો તમને અડચણરૂપ છે ?	()	()	()
૯૨-ડી તમે વારં વાર દુઃખ અનુભવો છો ?	()	()	()
૯૩-બી તમારે વારં વાર તબીબી તપાસની જરૂર પડે છે ?	()	()	()
૯૪-બી તમને જાહેરસભામાં ધણી જાતના અગ્રહ વધ્યા છે ?	()	()	()
૯૫-ધ તમને તમારી નોકરીમાં ઇર્ષ્યા ચઢતી મળી છે ?	()	()	()
૯૬-એ તમારા કુટુંબના કોઈ સભ્ય તમારી ઉપર કુકમ ચલાવે છે ?	()	()	()
૯૭-બી તમે ધણી વાર સવારના જીડીને ઘાંક અનુભવો છો ?	()	()	()
૯૮-ધ તમારી સાથે કામ કરતી કોઈ વ્યક્તિને એવી કોઈ ટેવ કે લક્ષણ છે કે જેથી તમે ચીડ અનુભવો ?	()	()	()
૯૯-સી તમે કોઈ જમણવારમાં કોઈ વસ્તુ ભેંઈતી હોય તો ને માંડ્યા વગર તેના વગર ચલાવી લેવું પસંદ કરો છો ?	()	()	()
૧૦૦-ડી તમને અંધારામાં એકલા હોવાથી બીક લાગે છે ?	()	()	()
૧૦૧-એ તમારા માન્યાય તમે એમની સાથે રહેતા ત્યારે તમારી ખૂબ જ દેખભાળ રાખતા હતા ?	()	()	()
૧૦૨-સી તમને વિરુદ્ધ જાતિની વ્યક્તિ (પ્રગુણ-ઓ) સાથે સહેલાઈથી મિત્રતા બાધી શકો છો ?	()	()	()
૧૦૩-બી તમારું વર્તન જરૂરિયાત કરતા ઓછું છે ?	()	()	()
૧૦૪-ઈ તમારી અભ્યાસની નોકરી તમને ખૂબ ઊનાવળ કરાવે છે ?	()	()	()
૧૦૫-ડી કોઈ છત્રી જગ્યાએ તમે ગયા હો તો તમને એવો ડર લાગ્યા કરતો કે તમે નીચે જૂસકો મારી દેશો ?	()	()	()
૧૦૬-એ તમે અભ્યાસ જેની સાથે રહો છો એમની સાથે તમારે સારું બને છે ?	()	()	()
૧૦૭-સી અભ્યાસે તમે જેની સાથે રહો છો તેની સાથે વાતચીત કરતા તમને તકલીફ પડે છે ?	()	()	()
૧૦૮-બી તમને વારં વાર ચક્કર આવે છે ?	()	()	()
૧૦૯-ડી તમે વારં વાર તમે કરેલ કાર્યોથી દુઃખી થાવ છો ?	()	()	()
૧૧૦-ઈ તમે પોતે કરેલ કોઈ કાર્યનું બધું જ માન તમારા ઉપરી અધિકારીને મળે છે ?	()	()	()
૧૧૧-એ તમારી સાથે રહેનાર વ્યક્તિ, વ્યક્તિઓ સાથે તમારે ઘરની બાબતો અંગે મતભેદો જોવા થાય છે ?	()	()	()
૧૧૨-ડી તમે સહેલાઈથી નાહિમન થઈ જાવ છો ?	()	()	()
૧૧૩-બી તમને છેલ્લા દસ વર્ષ દરમિયાન કોઈ (મોટી) ગણનાપાત્ર બિમારી થઈ છે ?	()	()	()
૧૧૪-સી તમને સોઢા માટે કોઈ યોજના તૈયાર કરવા કે સોડોની આગેવાની કરવાનો કોઈ અનુભવ છે ?	()	()	()

	ના ૧	અનિશ્ચિત ૨	હા. ૩
૧૧૫-ક તમને લાગે છે કે અત્યાચારની તમારી નોકરીમાં તમે અડચણરૂપ છે ?	()	()	()
૧૧૬-એ તમારી સાથે ધનમાં ગંદતી કોઈ વ્યક્તિ તમારા મિત્રો કે સાથીદારોની ગાળામાં વાંધા ઉત્પન્ન છે ?	()	()	()
૧૧૭-બી તમે વારંવાર હસુની બીમારી ભોગવો છો ?	()	()	()
૧૧૮-ઈ તમારા ઉપરી અધિકારી તમે કોઈ સુંદર કામ કરો તો તમારા વખાણ કરે છે ?	()	()	()
૧૧૯-સી લોકો સાથે કોઈ વિષય અંગે ચર્ચા કરવા તમારે સૌ પ્રથમ કોઈ વિચાર રજૂ કરવાનો આવે તો તમે મૂઝવણ અનુભવો છો ? (આત્મસંભાન થઈ જવો છે ?)	()	()	()
૧૨૦-ડી કોઈ તમારા માટે ખરાબ કહે તો તમે વારંવાર બેચેન થઈ જવો છો ?	()	()	()
૧૨૧-એ તમારા કુટુંબની કોઈ વ્યક્તિ જલદીથી ઉરોરાઈ જાય છે ?	()	()	()
૧૨૨-બી તમને ઘણી બધી વાર શરદી થઈ જાય છે ?	()	()	()
૧૨૩-ડી તમે વીજળીના ચમકારા કે ગડગડાટથી ત્રસ્ત થઈ જાવો છો ?	()	()	()
૧૨૪-સી તમને શરમાળવણીની મુશ્કેલી લાગે છે ?	()	()	()
૧૨૫-ઈ શું તમે તમારે નોકરી એટલા માટે લીધી છે કે તમને પોતાને આ નોકરી કરવા માટે ખૂબ ઇચ્છા હતી ?	()	()	()
૧૨૬-બી તમે પોતાના શરીર ઉપર કોઈ મોટી શસ્ત્રક્રિયા (ઓપરેશન) કરાવી છે ?	()	()	()
૧૨૭-ડી તમારા માતાપિતા તમારા મિત્રો ગાળામાં કોઈ વાંધા ઉડાવતા ?	()	()	()
૧૨૮-ઈ તમે તમારા અત્યાચારના કામમાં કોઈ વાર નાહિમત થઈ જાવો છો ?	()	()	()
૧૨૯-ડી તમારી પોતાની કોઈ જૂલ વસ્તુ વધુ તમારું કાર્ય પાર ન પડે એમ યત્ને છે ?	()	()	()
૧૩૦-એ તમે વધુ વ્યવસ્થાતંત્ર મેળવી શકો એ હેતુથી તમને તમારી અત્યાચારની જગ્યા છોડી બીજા જગ્યા જવાનું મન થાય છે ?	()	()	()
૧૩૧-બી તમે કોઈ માણસને સારી રીતે ઓળખતા ન હો અને તેની પાસે કોઈ ચીજ નેનું છેલ્લું હોય તો જાતે જઈને માગ્યા કરતા ચિઠ્ઠી લખી મંગાવવું વધુ પસંદ કરો છો ?	()	()	()
૧૩૨-બી તમે કોઈ અકસ્માતમાં જાંલી રીતે ધરાયા છો ?	()	()	()
૧૩૩-ડી તમને સાપને જોતા જ ખીક લાગે છે ?	()	()	()
૧૩૪-ઈ શું તમને એમ લાગે છે કે તમારું કરેલ કાર્ય ખૂબ અધિકારીઓ દ્વારા ચકાસવામાં આવે છે ?	()	()	()
૧૩૫-બી તાન્ત્રિકમાં જ તમે ખૂબ વજન ગુમાવ્યું છે ? (તમે ખૂબ સુકાઈ ગયા છો ?)	()	()	()
૧૩૬-એ શું પેસાની ખેડ તમારા કૌટુંબિક જીવનને દુખી બનાવે છે ?	()	()	()

	ના. ૧	અનિશ્ચિત ૨	હા. ૩
૧૩૭-સી શું સોદા સમક્ષ મૌખિક અહેવાલ આપવામા તમને તકલીફ પડે છે ?	()	()	()
૧૩૮-ઈ તમારી અત્યારની નોકરી તમને નીરસ લાગ્યા કરે છે ?	()	()	()
૧૩૯-ડી તમે જલદીથી રડી પડો છો ?	()	()	()
૧૪૦-બી શું ઘણીવાર તમે દિવસ પૂરો થતા થાક અનુભવો છો ?	()	()	()
૧૪૧-એ તમે તમારા માળાપ સાથે રહેતા ત્યારે તેઓ ખોટી રીતે તમારી ટીકા કરતાં ?	()	()	()
૧૪૨-ડી ધરતીકંપ કે આગના વિચારમાત્રથી તમને બીક લાગે છે ?	()	()	()
૧૪૩-સી કોઈ કાર્યક્રમ જોવા જવાનું હોય તો બંધા પોતાની જગ્યાએ બેસી ગ્રંથાં દોર્ય પછી અંદર ઘખલ થતા મુંઝાપ છો ?	()	()	()
૧૪૪-ઈ તમને એમ લાગે છે કે તમારી અત્યારની નોકરીમા તમને પોતાને ખરેખર રસ ખૂબ ઓછો છે ?	()	()	()
૧૪૫-બી તમને કોઈ જાતના અગાળે સતાવના ન હોય તો પણ કોઈ વાર સૂચમા તકલીફ પડે છે ?	()	()	()
૧૪૬-સી તમારે ધરે કોઈ એવી વ્યક્તિ છે કે જે માન આપવા યોગ્ય હોય કે ન હોય જતા પણ તે એમ ઇચ્છતી હોય કે તમારે તેને માન આપવું જ નેઈએ ?	()	()	()
૧૪૭-સી કોઈ પણ નીરસ પ્રસંગને રસભર્યો બનાવવા તમે પ્રયાસ કરો છો ?	()	()	()
૧૪૮-ગી શું તમને એમ લાગે છે કે તમારા નજીકના ઉપરી અધિકારીમા તમારા પ્રત્યે, એક નોકરિયાત પ્રત્યે, હોવી જોઈએ એટલો સલામતજીવી, સમજદારશક્તિ નથી ?	()	()	()
૧૪૯-ડી સોંધા સાથે હોવા જતા ઘણીવાર તમને એકલવાયાપણું લાગે છે ?	()	()	()
૧૫૦-એ એક યુવાન તરીકે તમારા મનમા કયારેય ધર્યા ભાગી જવાની ઇચ્છા થઈ આવી છે ?	()	()	()
૧૫૧-બી તમને માથાનો દુઃખાવો બહુ થાય છે ?	()	()	()
૧૫૨-ડી તમને કયારેય એમ લાગ્યું છે કે કોઈ કયારેય તમને પોતાના કાબુમા નઈ (વર્ગીકરણ કરી) તમારી ઇચ્છાઓ વિરુદ્ધ તમારી પામે કાર્ય કરાવવા ઇચ્છે છે ?	()	()	()
૧૫૩-મી સો કો સાથે વાત કરતી વખતે યોગ્ય અભિપ્રાય આપવામા તમે મૂંઝકલા અનુભવો છો ?	()	()	()
૧૫૪-ઈ તમને એમ લાગે છે કે પોતાનું કાર્ય ઉત્તમ રીતે કરવાના તમારા પ્રયત્નોને તમારા ઉપરી અધિકારી યોગ્ય રીતે ખીરદાવતા નથી ?	()	()	()
૧૫૫-બી તમને કયારેય ખીમારી થઈ છે ?	()	()	()
૧૫૬-એ તમને કયારેય એમ લાગે છે કે તમે તમારા માળાપ માટે મદદરૂપ નિવડ્યા નથી ?	()	()	()
૧૫૭-સી તમે કોઈ પ્રસંગે સો કોની ઓળખાણ કરાવવાની જવાબદારી લો છો ?	()	()	()
૧૫૮-ઈ તમને અત્યારની તમારી નોકરી ગ્રામીણ દેવાને ડર પડે છે ?	()	()	()
૧૫૯-ડી ગરવાનું તમારો મુઠ ખરાબ થઈ જાય છે ?	()	()	()
૧૬૦-સી તમે આસાની થી કોઈની મદદ માંગી રહો છો ?	()	()	()

Record Form
MALIN INTELLIGENCE SCALE FOR INDIAN CHILDREN (MISIC).

NAME :SEX :
ADDRESS :
FATHER'S NAME :MOTHER'S NAME :
SCHOOL :CLASS :

	YEAR	MONTH	DAY		RAW SCORE	I. Q.
Date tested				Verbal Scale		
Date of Birth				Performance Scale		
Age				Total		

VERBAL TESTS	Raw Score	I. Q.	PERFORMANCE TESTS	Raw Score	I. Q.
Information			Picture Completion		
Comprehension			Block Design		
Arithmetic			Object Assembly		
Similarities			Coding		
Vocabulary			Mazes		
(Digit Span)					
Sum of Verbal Tests			Sum of Performance Tests		

1. INFORMATION TEST

Response	Score	Response	Score
1.		16.	
2.		17.	
3.		18.	
4.		19.	
5.		20.	
6.		21.	
7.		22.	
8.		23.	
9.		24.	
10.		25.	
11.		26.	
12.		27.	
13.		28.	
14.		29.	
15.		30.	

IV. ANALOGIES & SIMILARITIES TEST :

Response	Score	Response	Score
1.		9.	
2.		10.	
3.		11.	
4.		12.	
5.		13.	
6.		14.	
7.		15.	
8.		16.	

II. GENERAL COMPREHENSION TEST :

Response	Score	Response	Score
1.		9.a)	
2.		b)	
3.		10. a)	
4.		b)	
5.		11. a)	
6.a)		b)	
b)		12. a)	
7.a)		b)	
b)		13. a)	
8.a)		b)	
b)		14. a)	
		b)	
Total			

III. ARITHMETIC TEST :

Problem	Response	Score
1. 45''		
2. 45''		
3. 45''		
4. 30''		
5. 30''		
6. 30''		
7. 30''		
8. 30''		
9. 30''		
10. 30''		
11. 60''		
12. 30''		
13. 60''		
14. 120''		
15. 120''		
16. 30''		
Total		

VIII. BLOCK DESIGN :

Design	Time Pass - Fail	Score
A. 45''		
B. 45''		
C. 45''		
1. 75''		
2. 75''		
3. 75''		
4. 75''		
5. 150''		
6. 150''		
7. 150''		
Total		

VI DIGIT SPAN :

FORWARDS		BACKWARD	
Response	Score	Response	Score
Series		Series	
3a)		2a)	
b)		b)	
4a)		3a)	
b)		b)	
5a)		4a)	
b)		b)	
6a)		5a)	
b)		b)	
7a)		6a)	
b)		b)	

V VOCABULARY TEST :

Response	Score	Response	Score
1.		21.	
2.		22.	
3.		23.	
4.		24.	
5.		25.	
6.		26.	
7.		27.	
8.		28.	
9.		29.	
10.		30.	
11.		31.	
12.		32.	
13.		33.	
14.		34.	
15.		35.	
16.		36.	
17.		37.	
18.		38.	
19.		39.	
20.		40.	

VII PICTURE COMPLETION :

IX OBJECT ASSEMBLY :

Response	Score	Response	Score
1.	Manikin 120"		
2.	Horse 180"		
3.	Face 180"		
4.	Auto 180"		
5.			
6.		Total	
7.			
8.			
9.			
10.		X CODING	
11.		Time (120) :.....	Score (No. Right)
12.			
13.			
14.			
15.			
16.			
17.			
18.			
19.			
20.			
Total			

XI. MAZES :

Maze	Maximum Errors	Errors	Score
A. 30"	2		
B. 30"	2		
C. 30"	2		
1. 30"	3		
2. 45"	3		
3. 60"	5		
4 120"	6		
5 120"	8		
		Total.....	

9	T
8	+
7	(
6	>
5	□
4	L
3	+
2	)
1	÷

0124


6

TIME (120") _____ SCORE (NO. RIGHT) _____


SUBJECT

NAME_____


MAZE TEST




B




A




SAMPLE




1
30



C
30




3
60




2
35

COUNSELLOR ↓



4
120



5
120

COUNSELLOR ^